

માર્ચ 1, 2019

**બ્રામ્પટન સ્માર્ટ સીટીસ ટેકનોલોજીસ વિષય પર આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનનું સહિયારું યજમાન બન્યું
આયોજન ત્યારે થયું જ્યારે આ શહેર કેનેડામાં ટેકનોલોજીકલ અને નવીન શોધ માટેનું હોટસ્પોટ બનવા પોતાની
ગતિ વધારી રહ્યું છે.**

બ્રામ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 1, 2019) – દુનિયાભરના શહેરો સામાજિક, આર્થિક અને પર્યાવરણલક્ષી મોરચે બહુવિધ પડકારોનો સામનો કરતા હોવાને લીધે, સરકારોએ શહેરી વિકાસ કાયમી ચાલુ રાખવા નવીન ટેકનોલોજીઓનો ઉપયોગ અને ધંધાઓ, વિશ્વવિદ્યાલયો અને સમુદાયો સાથે સહયોગ અચૂક કરવો રહ્યો, મંગળવાર, ફેબ્રુઆરી 26, 2019 નાં રોજ બ્રામ્પટનમાં સ્માર્ટ સીટીસ ટેકનોલોજીસ સમિટમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોએ કહ્યું.

આ આયોજનમાં, જેમાં સીટી ઓફ બ્રામ્પટન અને ઈન્ફર્મેશન ટેકનોલોજી એસોસિએશન ઓફ કેનેડા (ITAC) સહિયારા યજમાન બન્યા, સમગ્ર કેનેડા અને યુરોપમાંથી પણ, નગરપાલિકાઓ, ટેકનોલોજીકલ કંપનીઓ અને વિશ્વવિદ્યાલયોના નિષ્ણાતો ભેગા થયા હતા. ચર્ચાઓ માનવ ચલાયમાનતા (હ્યુમન મોબિલિટી), ડેટા ગુપ્તતા અને સલામતી, ડિજિટલ ટ્રાન્સફર્મેશન નેટવર્ક્સ, શહેરી સેવાઓ અને નાગરિક નવીન શોધના આધુનિકીકરણ પર કેન્દ્રિત થઈ હતી.

આ શિખર સંમેલન દુનિયાભરના શહેરોમાં જનસંખ્યાઓ કેવી રીતે ઝડપથી વધે છે તેના સંદર્ભમાં યોજાયું. તાજેતરના UN અહેવાલ અનુસાર, આજની 55 ટકાની સરખામણીમાં, વર્ષ 2050 સુધીમાં 68 ટકા જેટલી વૈશ્વિક વસ્તી શહેરોમાં રહેતી હશે. આ વસ્તીવધારો જીર્ણ થતી શહેરી માળખાગત સગવડો (અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર), અને શહેરોમાં ખાદ્ય પદાર્થો, પાણી, ઊર્જા, આરોગ્યસંભાળ, પરિવહન અને સુરક્ષા માટે અપૂર્વ ખર્ચ પર નોંધપાત્ર દબાણ પાડી શકે છે.

પેનલ સભ્યોને એ મંતવ્ય આપતા પણ ચેતવવામાં આવે છે જે દરેક શહેરી સમસ્યા માટે ટેકનોલોજીને “બધાં જીવો, બધાંના અંતનું કારણ” તરીકે જોતા હોય. સ્માર્ટ સીટી પ્લાનર્સ માટે ટેકનોલોજીને વટાવી જતા રચનાત્મક ઉકેલોની વિવિધતાને એકીકૃત કરવી અનિવાર્ય છે, જેમ કે સર્વગ્રાહી સામુદાયિક સમાવેશ અને શૈક્ષણિક અને ધંધાકીય ક્ષેત્રો સાથેનો સહયોગ.

આ આયોજન એવા સમયે કરવામાં આવ્યું જ્યારે બ્રામ્પટનમાં સંખ્યાબંધ પરિયોજનાઓ થઈ રહી છે જે નવીન શોધ, ટેકનોલોજી અને નોકરી સર્જવાને પ્રોત્સાહિત કરે.

આ પરિયોજનાઓમાં તાલીમ અને પ્રમાણપત્ર, સંશોધન અને વિકાસ, અને આ વિકાસશીલ ક્ષેત્રમાં વાણિજ્યિક નવીન શોધને પ્રોત્સાહિત કરવા સાઈબર સુરક્ષા માટેનું રાષ્ટ્રીય કેન્દ્ર, સાઈબર સિક્યોરિટી કેટાલિસ્ટ શરૂ કરવા રાયરસન યુનિવર્સિટી સાથે ભાગીદારી કરવાનો સમાવેશ થાય છે.

આપણું શહેર ડાઉનટાઉન બ્રામ્પટનમાં ઈન્ક્યુબેટર જગ્યા શરૂ કરવા રાયરસન સાથે પણ સહયોગ સાધી રહ્યું છે, જેની ડિઝાઇન ઊભરી રહેલા સ્ટાર્ટઅપ્સ અને સ્થાપિત ધંધાઓ, એમ બંનેને ટેકો આપવા કરવામાં આવી છે.

અવતરણો (ક્વોટ્સ):

“બ્રામ્પટન – કેનેડાનું બીજું સૌથી ઝડપથી વિકસતું અને સૌથી જુવાન શહેર – ITAC સાથે આ સમિટના સહિયારા યજમાન બનવા બંધબેસતું છે. આ આયોજન એવા સમયે થયું જ્યારે બ્રામ્પટનમાં રોમાંચક વિકાસો થઈ રહ્યાં છે, જે કેનેડાના સૌથી ઝડપથી ઊભરી રહેલા ટેકનોલોજીકલ

અને નવીન શોધ સ્થળોમાંના (હોટસ્પોટના) એક તરીકે બ્રામ્પટનના દાવાને બળ પૂરું પાડે છે. આપણું શહેર દુનિયામાં સૌથી સ્માર્ટ શહેરી સ્થળોમાંનું એક બનવા ઘણાં ઘટકો ધરાવે છે, જેમ કે નોકરીઓ સર્જવી.”

- મેયર પેટ્રિક બ્રાઉન (*Patrick Brown*)

“બ્રામ્પટનમાં આ શિખર સંમેલનના સહિયારા યજમાન બનવું એ કેનેડાની ટેકનોલોજી અને નવીન શોધના મંચ પર બ્રામ્પટનના વધી રહેલા પ્રભાવની સ્પષ્ટ નિશાની છે. બ્રામ્પટન પોતે ટોરોન્ટો-વૉટરલૂ ઈનોવેશન કોરિડોરની મધ્યમાં સ્થિત છે, જે પ્રતિભાઓ, શિક્ષકો, ઉદ્યમીઓ અને ઉચ્ચ-વિકાસ પેઢીઓને સાંકળે છે. G7 માં કોઈપણ ટેકનોલોજી હબના સૌથી ઓછા ધંધાકીય ખર્ચ – અને ટોચની આંતરરાષ્ટ્રીય પેઢીઓ સાથે તેની ઘનિષ્ઠતાને લીધે – બ્રામ્પટન સ્માર્ટ સીટીસની કલ્પનાને સાકાર કરવા, અને છેવટે શહેરી વાતાવરણની ગુણવત્તા સુધારીને લોકોની સેવા કરવા સારી સ્થિતિમાં છે.”

- જોસેફ પિટ્ટારી (*Joseph Pittari*), વચગાળાના મુખ્ય વહીવટી અધિકારી, (ઈન્ટરીમ ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર), સીટી ઓફ બ્રામ્પટન

-30-

બ્રામ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતા ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રામ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર અનુસરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક:

મોનિકા ટુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રામ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca